

# SHANTAI INDUSTRIES LIMITED

CIN: L74110GJ1988PLC013255

Reg Office: 820, Golden Point, Nr. Telephone Exchange, Begampura, Falsawadi, Ring Road, Surat-395003  
Website: www.shantaiindustrieslimited.com , Email-id: shantaiindustriesltd@gmail.com, Tel: 9913425000

Date: 09/08/2022

To,

**BSE LIMITED**

Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai- 400 001.

Scrip Code : SHANTAI/ 512297

Subject : Intimation of Newspaper Advertisement of Extract of standalone unaudited financial results for the Quarter Ended 30<sup>th</sup> June, 2022

Reference No. : Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Unaudited Financial Result for the Quarter ended on 30th June, 2022 published in Newspapers on Tuesday, 09th August, 2022

1. English Daily: "Free Press Gujarat" dated 09<sup>th</sup> August, 2022
2. Regional Language Daily: "Lokmitra" dated 09<sup>th</sup> August, 2022

You are requested to kindly take the same on record.

Yours Faithfully,  
**Thanking you**

**For Shantai Industries Limited**

SHANTAI INDUSTRIES LIMITED



**Harishbhai Fatandas Sawlani**  
**Managing Director**  
**DIN: 00831848**

**Place: Surat**

Encl: Copy of Newspaper

**Ahmedabad based Pharma Company develops Therapeutic Prevention medicines for Cancer & Neurology**



**Ahmedabad :** Rayo Pharma which was established in year 2018 with the vision of serving the quality medicine for wellness of human beings and which has been always been supported by leading Health Practitioners for its quality & commitment, today announced that as an addition to their basket Preventive Medicine in therapeutic segment of Oncology & Neurology, the company has launched 2 Brands ONCOREX for Preventive Care for Cancer

and NEUROMAKE for Preventive care of Neuro Degenerative Disorders like Alzheimer's disease. In a Media briefing session organized on the topic of Therapeutic Preventive Medicine, Dr Nehal Sadhu (MD - Medicine) and Mr Sanjay Parikh (CEO of Rayo Pharma shared, "Since our inception in year 2018, we have initiated with the Allopathic treatment products in the Therapeutic range of products for Gynaecology, Dermatology & Critical Care products. (19-8)

**FREE YOUR MIND FROM THE DAILY GRIND WITH THE NEW ROYAL ENFIELD HUNTER 350**



Ahmedabad, Royal Enfield, the global leader in the mid-size (250-750cc) motorcycle segment, today launched the new Hunter 350, a 'two-wheeled double-esspresso' of motorcycling. Engineered and designed for the urban hustle, the new Hunter 350 is a remixed roadster with the character of a Royal Enfield remastered in a stylish, compact-yet-muscular geometry, that can tackle crowded city streets, suburban backroads and beyond, with aplomb. As the motorcycling world shifts from the elaborate and complex to a functional and simplistic one that's high on design ingenuity and self-expression, Royal Enfield tasked itself with building a big city motorcycle that fits perfectly into the planet's coolest neighbourhoods - from Mumbai to Bangkok, New York to London. A motorcycle that's refreshingly new but exudes old school cool and retains that essential Royal Enfield DNA. While it took time to distill, the Hunter 350 is that perfect blend - an incredibly joyful, muscular motorcycle that exudes retro-retro style, that packs in all the intense flavours of pure motorcycling and saves them up in a stylish, city-friendly sort of exhilaration. Speaking about the inspiration behind the Hunter 350, Siddhartha Lal, Managing Director of Eicher Motors Ltd. said, "At Royal Enfield we are closely engaged with our consumers and community. (19-7)

**This August on MX VDesi, watch the specular slate of blockbuster International shows**



dropping new shows every Wednesday - depicting varied emotions from the varied regions across the globe - all on your screens. So, get the popcorn cracking and enjoy the August binge-fest, every Wednesday only on MX VDesi. Kick-starting the binge-fest with a blockbuster 16-episode Korean drama - "One Woman" featuring an avalanche of emotions. Dubbed in Hindi, Tamil, Telugu, Marathi, Bengali, Kannada and Malayalam, it's much like the comedy of errors. This show follows the story of a tough female prosecutor who switches places with her doppelganger with completely opposite characteristics after an accident. What follows is chaos and leads of fun for the viewers. Exclusively available on MX Player, stream this K-drama now. Up next we have "Kuzgun" a family drama like no other! This 71 episode Turkish drama radiates all the emotions possible on the spectrum. (19-8)

**SHRI AJAY PATEL ELECTED AS A "ZONE 3.1.7 PRESIDENT" OF FIDE UNOPPOSED**

Ahmedabad, During recently concluded FIDE election on 7.8.2022 at Mahabalipuram, Chennai, Mr. Ajay Patel (Vice President of Gujarat State Chess Federation) elected as a "Zone 3.1.7 President" of FIDE (World Chess Federation) "Unopposed". The whole team of Arkady Dvorkovich wins during this election process.



directly involved with Zone President for administrative purpose. For easy administration and give qualification slot to players in major world events FIDE created zones with single or Multiple Countries. FIDE given separate Zone status to India as Asian Zone 3.1.7. Under the guidance of Shri Ajaybhai, the 44th Chess Olympiad is organised successfully as a Chairman of Organising Committee Shri Ajaybhai Patel played tremendous role. Without his guidance and foresight, it is not possible to organised such as big event in a very short span of time i.e. just 3 months.

**Monsoon Collection by Corneliani India**



Ahmedabad - For the regained sense of pure elegance and savoir-faire, Corneliani, an Italian menswear fashion giant has launched its Spring/Summer 2022 collection which focuses on traditional menswear archetypes and sartorial separates. Infused with a touch of Nostalgic escapism this collection consist of classic polo T-shirts, minimal graphic printed T-shirt with muted tones, shirt jackets, woolen jackets, cardigans fabricated from sustainable cotton, chino trousers and collared shirts which is inspired by a Mediterranean summer. Authentic masculine elegance is brought back with soft tailoring, elaborate precision and detailing, as true luxury in the designer's eye comes from quality, good taste and the confidence that a man senses when feeling comfortable and at ease in his clothes. Price on request. Available at Corneliani boutique in: Delhi: DLF Emporio, Vasant Kunj, New Delhi # 011-4604071/72

**A hint of stability: On Sri Lanka's new dispensation**

With a new government in Sri Lanka, India must review its options in extending more help. As a leader who was the lone member of his party in Parliament, Ranil Wickremesinghe can only see his victory in Sri Lanka's presidential elections on Wednesday as a political windfall. However, the position comes with a crown of thorns. His first challenge will be to reach out to the people, including the protesters in Colombo demanding his resignation, which is something politicians usually do before they win an election, not after. Building credibility with them will require distancing himself from the very faction of the ruling SLPP backed by Mahinda Rajapaksa that won him the elections. If he fails to satisfy the "street", then general elections, which Sri Lanka can barely afford at this point, will be the only remaining course.

**Quit India Day reminds us of the great mass movement organized under the leadership of Mahatma Gandhi**



Vinod Chandrasekhar Dixit Free-lance Journalist, Writer & Cartoonist (dixitpatrakar@yahoo.in)

August 8 is celebrated as Quit India Movement day. On this day, Father of the nation, Gandhiji gave a call to the masses and urged them to raise their voice against British and asked them to "Quit India". Gandhiji kick-started the Quit India movement on August 8, 1942, at the All India Congress Committee meeting in Mumbai's Gowalia Tank Maidan. He also infused it with the spirit of his phrase "do or die". On August 9, 1942 the Quit India Movement began which later triggered the British leaving the country and India attaining independence on August 15, 1947 a few years later. "Quit India" slogan is credited to another Congress leader, Yusuf Meherally, who is said to have come up with the phrase at a meeting of Gandhi's close associates in Mumbai some time before the launch of the movement. At the time, 39-year-old Meherally was the



major of Bombay - the first socialist to be elected to the post. Quit India day is observed every year on August 9 to mark the anniversary of Quit India movement. It was Mahatma Gandhi, who inspired the people of this vast nation to raise their voice against the oppressive British rule in a non-violent manner through this movement. The Quit India Movement also known as India August Movement or Bharat Chhodo Andolan was launched at the Bombay session of the All India Congress Committee (AICC) by Mahatma Gandhi on August 8, 1942, it is also known as August Kranti or August Movement. In early hours of 9th August, all the top leaders - Gandhi, Nehru Patel, Azad were arrested and Congress was declared an unlawful organization. Mahatma Gandhi delivered his speech marking the beginning of the Quit India Movement in Mumbai's Gowalia Tank Maidan also known as August Kranti Maidan. Besides Gandhi's ideology of non-violence and technique of Satyagraha, it was the strategy of struggle-truce-struggle that accelerated and sustained the urge for freedom and enabled India to achieve freedom in 1947. The efforts of Cripps mission bore no fruit and the prices of essential commodities were soaring high and the day does not appear to be far off for the deliverance from the British imperialism. With the arrest of all the national leaders, there was nobody to guide the popular agitation. The All India Congress Committee that met in Bombay in August ratified this decision to go in for struggle. In his speech Gandhi made it very clear "I am not going to be satisfied with anything short of complete freedom. May be, he (the Viceroy) will propose the abolition of salt tax, the drink evil. But I will say nothing less than freedom". Our PM Modi has also termed the month of August as a month of revolution as the non-cooperation movement was launched on 1st of August 1920. Quit-India movement on 9th of August 1942 and on 15th August 1947 India became independent. The Quit India day is a way of commemorating the brave soldiers of the Indian freedom movement. Functions are organized in numerous schools across the nation to educate the younger generation about the great sacrifices made by the martyrs and the leaders of the nation to make India independent. Let us remember that the Quit India movement was the spontaneous participation of the masses compared to the earlier non-cooperation and civil disobedience movements. The Quit India Movement was an important milestone in the Indian freedom struggle. Under the leadership of Mahatma Gandhi, people across India came together to uproot imperialism. Gandhi was a great strategist of the 20th century mass political mobilization process motivated by self-reliance rule of the masses through more of non-violent means. (B-15) Jyoti-Kalash Society, Jodhpur Tekra, Satellite, Ahmedabad - 380 015

**SHANTAI INDUSTRIES LIMITED**  
CIN: L74106G1988PLC013255  
Reg Office : 820, Golden Point, Nr. Telephone Exchange, Begumpura, Falsawadi, Ring Road, Surat-395003 Tel: 9913425000  
Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaidustriesdtd@gmail.com

Sl. No.	Particulars	Quarter ended 30th June 2022		Year ended 31st March 2022	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	1.957	2.021	-	116.901
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-0.846	-5.187	-9.120	2.193
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-0.857	-5.204	-9.120	2.176
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-0.857	-5.204	-9.120	2.176
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-0.857	-5.204	-9.120	2.176
6	Paid-up Equity Share Capital (face value of Rs. 10/- each)	150	150	150	150
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	601.770
8	Earnings Per Share (face value of Rs. 10/-each) (for continuing and discontinued operations)				
	1. Basic	-0.057	-0.347	-0.610	0.145
	2. Diluted	-0.057	-0.347	-0.610	0.145

Note: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.shantaidustrieslimited.com.  
2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 08th August, 2022.  
3. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

For Shantai Industries Limited Sd/-  
Harishbhai Fatandas Sawani  
Managing Director  
DIN: 00831848

**PARKER AGROCHEM EXPORTS LIMITED**  
CIN: L24110G1993PLC021012  
Registered Office: Block H, Plot 3 & 4, New Kandla - 370 2710 (Kutch)  
Corporate Office: 401, 4th Floor, Turquoise Building, Panchwati Five Roads, Ahmedabad-380006 (Gujarat)

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2022 (Rs. In Lacs)

Particulars	Quarter ended on 30-06-2022		Quarter ended on 31-03-2022	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations	93.77	29.09	-	831.23
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items #)	(6.34)	(53.95)	(90.27)	(90.27)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items #)	(6.34)	(53.95)	(90.27)	(90.27)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items #)	(6.34)	(53.95)	(90.27)	(90.27)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(6.34)	(53.95)	(90.27)	(90.27)
Equity Share Capital	477.90	477.90	477.90	477.90
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	(241.44)
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	(0.13)	(1.13)	(1.89)	

Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.  
2. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and on the website of the Company (www.parkersagrochem.com).  
3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

By Order of the Board,  
For PARKER AGROCHEM EXPORTS LIMITED Sd/-  
JAGDISH R. ACHARYA (DIN No. 01251240)  
CHAIRPERSON & MANAGING DIRECTOR

PLACE: AHMEDABAD  
DATE: 8TH AUGUST, 2022

**SYMBOLIC POSSESSION NOTICE**

**ICICI Bank** Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No- B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) Row Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notices upon the borrowers mentioned below, on underlying pool assigned to ICICI Bank by Dewas Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a housing loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ (Loan Account Number) (DHFL Old LAN & ICICI New LAN)	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand/ Notice/ In Demand	Name of Branch
1.	Arunbhai Virsukhbhai Mukataiwala & Kajal Arjun Mukataiwala-QZSUR00005019630 (DHFL Old LAN- 04100007094 & ICICI New LAN- QZSUR00005019630)	Flat No. Q/104, Rajhans Platinum, Near L. P. Savani School, Ugat Canal Road, Mouje Palanpore, Surat 220309/ August 04, 2022	June 19, 2021/ Rs. 26,28,907.00/-	Surat

The above-mentioned borrowers(s) guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: August 08, 2022  
Place: Surat  
Authorized Officer  
ICICI Bank Limited

**Arman Holdings Limited**  
Registered Office : 419, Rajhans Heights, Mini Bazar, Varachha Road, Surat- 395006.  
Tel : 9586006569. Email Id : armanholdingshd@gmail.com. Website : www.armanholdings.in  
CIN : L65993G1982PLC082961

Extracts of Standalone Unaudited Financial Results for the First Quarter Ended 30/6/2022 (Amt. Rs. In Lakhs)

Particulars	3 months ended 30/06/2022		3 months ended 30/06/2021	
	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income from Operations (net)	81.77	122.18	122.18	406.89
Net Profit from ordinary activities after tax	0.62	0.89	2.44	2.44
Net Profit for the period (after extraordinary items)	0.62	0.89	2.44	2.44
Paid-up Equity share capital (Face Value of Rs. 10/-each)	521.05	521.05	521.05	521.05
Earnings Per Share (before extraordinary items)				
(a) Basic	0.012	0.017	0.063	0.063
(b) Diluted	0.012	0.017	0.063	0.063
Earnings Per Share (after extraordinary items)				
(a) Basic	0.012	0.017	0.063	0.063
(a) Diluted	0.012	0.017	0.063	0.063

Note: 1. The above results is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the stock exchange website, i.e., www.bseindia.com and company's website, i.e., www.armanholdings.in

For Arman Holdings Limited Sd/-  
Deepak Kumar Babel  
Managing Director  
DIN : 05200110

Date : 01/08/2022  
Place : SURAT



